



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ20200908/3918

અરજી તા.:- ૦૮/૦૮/૨૦૨૦

પરિણેત્ર નં.:- ૭૩૩/૧ તા.:-૦૮/૦૮/૨૦૨૦.

અરજદારશ્રી, અનિલ ગાંધી,

નારણપુરા, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

મોજે/ રેવન્યુગામ :- સૈજપુર બોધા

રે. સર્વે. નંબર:- :- ૧૭૩/પૈકી

રી.ડી.પી. શીટ નં. :- ૯૩

ની જમીન "રહેણાક ઝોન ૧(એક) R1 " માં આવે છે, તેમજ BRTS અનુસંધાને કલમ (૧૨) (૨) (m) મુજબ પશ્ચિમ દિશાનો પાઈ ભાગ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન-(TZ) માં આવે છે.

નોંધ:

૧. સદરહુ જમીન ફાફટ મંજુર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.:- ૬૬, (સૈજપુર બોધા-ઇસ્ટ)ના વિસ્તારમાં આવતી હોવાથી તેને ટા.પ્લા. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો- જોગવાઈઓ ફેરફારને તથા ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રીના નિર્ણયને બંધનકર્તા રહેશે.

૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

તારીખ: ૦૧/૦૧/૨૦૨૦.

જ. ફાફટસમેન

ફ

હેડ ફાફટસમેન

ખરી નકલ

(Signature)
૧૧/૧/૨૦૨૦

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ.

PART PLAN SHOWING

R.S. NO.:- 173/p

VILLAGE :- SAHIJPUR BOGHA

TALUKA:- ASARWA

DISTRICT:- AHMEDABAD




c/89

1 c.m. = 40 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt.of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Residential Zone I-R1
- Transit Oriented Zone-TZ
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road
- BRTS
- National Highway



This part plan is certified for the R.S. NO. :- 173/p

- NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
- (2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2020.0308.3317 / 08/09/2020
Amount Recieved Rs.1000/-
Receipt No.....733/2..... Dtd.....08/09/2020.

TRUE COPY

Prep. By:

Chd. By:

H. D' man:

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

AHMEDABAD MUNICIPAL CORPORATION

PART PLAN SHOWING LOCATION AS PER T.P. SCHEME

THIS PART PLAN IS CERTIFIED ONLY FOR FINAL PLOT NO.: **43/2/1** OF
DRAFT TOWN PLANNING SCHEME AHMEDABAD NO:- 66 SAIJPUR BOGHA EAST
Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat
Notification NO:- GH/V/323 of 2006 - TPS - 112006 - 2710 - L Dt.15/12/2006


c/1091

COLOUR NOTE:-

- | | |
|-------------------------------|--|
| (1) BOUNDARY OF FINAL PLOT | |
| (2) BOUNDARY OF ORIGINAL PLOT | |
| (3) ROAD | |
| (4) BOUNDARY OF T.P. SCHEME | |



SCALE:-1CM=20 M



Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

(2) IN CASE OF DRAFT T.P. SCHEME THE ABOVE PART-PLAN WILL BE SUBJECT TO CHANGES AS MAY BE SANCTIONED BY GOVERNMENT OF GUJARAT IN THE FINAL T.P. SCHEME .

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે સીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં.પ. 120200908/1413 તા. 8-9-2020 થી
નકલની માંગણી કરેલ હોઈ પલોચ નં. 233/03 તા. 8-9-2020 થી
રૂ. 1000... વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

TRUE COPY

[Signature]
9/9/2020

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

TRACER

[Signature]
જી. ડ્રાફ્ટ્સમેન
જાન્યુઆરી 2020

[Signature]
જી. ડ્રાફ્ટ્સમેન
જાન્યુઆરી 2020

0-20201208/9994

(III) તા. ૨૦/૧૨/૨૦૧૪ ના રોજ ના. સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ પુનરાવર્તિત વિકાસ નકશા પરથી અભિપ્રાય
Ref :- Description of Land :

93

T.P.S. No. & Name 66 Saigpur-bogha East (partly sanctioned)
F.P.No. 46/2 S.P. No. 173/B Tena.No. 173/B Block No. 173/B
Rev.Village Saigpur-bogha R.S. No. 173/B Block No. 173/B
Gamtal 173/B Sheet No. 173/B C.S. No. 173/B

- વપરાશ ઓન: રહેણાંચ કોમિટી (સેક્ટર) ના સભ્યો દ્વારા રજીસ્ટ્રેશન નં. 173/12 ને મુજબ BRTS અંગ્રજીમાં રજીસ્ટ્રેશન નં. 173/12
 - સી.પી.ઓ. (સી.પી.ઓ.) ના આદેશ મુજબ રજીસ્ટ્રેશન નં. 173/12 ના ક્ષેત્રમાં મીટરનો, પશ્ચિમ દિશાએ 300 મીટરનો, ઉત્તર દિશાએ 750 મીટરનો તથા દક્ષિણ દિશાએ મીટરનો ટી.પી./હયાત/નામ/લાઈન રોડ પસાર થાય છે, તે મુજબ દરેક માપો પ્લાનમાં દર્શાવવા, સ્થળે નકશા મુજબના માપો ચેક કરી, રોડની જગ્યા ખુલ્લી છોડાવી, આગળની જરૂરી કાર્યવાહી કરવી તથા નિયમ અનુસાર રોડ ગોળાઈ દર્શાવતી તેમજ લાગુ નંબરો તથા નોર્થ લાઈન દર્શાવતી રેફરન્સમાં જણાવેલ પ્લોટને ટી.પી. રોડ લાઈનની નીચે મુજબની અસર થાય છે/થતી નથી.
 - X પૂર્વ દિશાએ આવેલ મીટરનો ટી.પી. રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ મીટરનો થાય છે.
 - X પશ્ચિમ દિશાએ આવેલ મીટરનો ટી.પી. રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ મીટરનો થાય છે.
 - X ઉત્તર દિશાએ આવેલ મીટરનો ટી.પી. રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ મીટરનો થાય છે.
 - X દક્ષિણ દિશાએ આવેલ મીટરનો ટી.પી. રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ મીટરનો થાય છે.
 - X જેના લીધે સદરહુ પ્લોટની પૂર્વ/પશ્ચિમ/ઉત્તર/દક્ષિણ બાજુએ રોડની સમાંતર મીટરની કપાત થાય છે, જે લેઆઉટ પ્લાનમાં માપ સાથે દર્શાવી સ્થળે ખુલ્લી છોડાવવી તથા તે સંદર્ભે પ્લોટની સ્થિતિ તથા તેના ક્ષેત્રફળને થતી અસર લે-આઉટ પ્લાનમાં તથા એરીયા ટેબલમાં દર્શાવી અને તે સબબ આનુષંગિક નિયમોની થતી અસર ચકાસી પ્રવર્તનમાન નિયમો અનુસાર આગળની જરૂરી કાર્યવાહી કરવી.
 - રેફરન્સમાં જણાવેલ પ્લોટની દિશાએ રેલ્વે લાઈન આવેલ છે.
 - રેફરન્સમાં જણાવેલ પ્લોટ ગાંધીઆશ્રમ કોમ્પ્લેક્સ એરીયા ઈમ્યુવમેન્ટ યોજના વિસ્તારમાં આવેલ છે.
 - રેફરન્સમાં જણાવેલ પ્લોટ સાબરમતી રીવર ફ્રન્ટ કંટ્રોલ એરીયામાં આવેલ છે.
 - રેફરન્સમાં જણાવેલ પ્લોટ સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ વિસ્તારમાં આવેલ છે.
 - મેટ્રો રેલ રૂટની અસર થાય છે/થતી નથી.
 - સદરહુ નંબર S.P. રીગરોડની અંદર આવે છે/બહાર આવે છે.
 - કબજા ફેરફાર અંગે આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
 - સેન્ટી.પી. વિસ્તાર/ફાઈટ સ્કીમમાં ટી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
- જેમાં ટી.પી.ઓ. (સી.પી.ઓ.) ના આદેશ મુજબ રજીસ્ટ્રેશન નં. 173/12 ના ક્ષેત્રમાં મીટરનો, પશ્ચિમ દિશાએ 300 મીટરનો, ઉત્તર દિશાએ 750 મીટરનો તથા દક્ષિણ દિશાએ મીટરનો ટી.પી./હયાત/નામ/લાઈન રોડ પસાર થાય છે, તે મુજબ દરેક માપો પ્લાનમાં દર્શાવવા, સ્થળે નકશા મુજબના માપો ચેક કરી, રોડની જગ્યા ખુલ્લી છોડાવી, આગળની જરૂરી કાર્યવાહી કરવી તથા નિયમ અનુસાર રોડ ગોળાઈ દર્શાવતી તેમજ લાગુ નંબરો તથા નોર્થ લાઈન દર્શાવતી રેફરન્સમાં જણાવેલ પ્લોટને ટી.પી. રોડ લાઈનની નીચે મુજબની અસર થાય છે/થતી નથી.
- પ્લાનમાં વિસ્તારમાં ACP નં. 03/11/2020 ના અભિપ્રાય મુજબ તબક્કા ૨૨૦૦
- સદરહુ અનુદાન/ફાઈટ સ્કીમમાં ટી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
- સદરહુ અનુદાન/ફાઈટ સ્કીમમાં ટી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
- સદરહુ અનુદાન/ફાઈટ સ્કીમમાં ટી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
- સદરહુ અનુદાન/ફાઈટ સ્કીમમાં ટી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
- વિશેષ નોંધ: TOZ અંગે LCP ના અભિપ્રાય (LAP) અભિપ્રાય મેળવવા કાપડારી કરવાની રહેશે.
- પ્રવર્તન નીતિ નિયમો, અભિપ્રાય, પરિપત્રો તથા તે સબબ આનુષંગિક બાબતો તેમજ પ્રવર્તમાન સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો (જી.ડી.સી.આર.) ની જોગવાઈ ચકાસી આગળની આનુષંગિક કાર્યવાહી કરવા વિનંતિ.
 - સરકારમાં સાદર કરેલ ફાઈટ ટાઉન પ્લાનીંગ સ્કીન વિસ્તારમાં સમાવિષ્ટ થતા પ્લોટ માટે પ્રથમ ટાઉન પ્લાનીંગ ઓફીસરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતાનો અભિપ્રાય મેળવી તેઓના અભિપ્રાય મુજબની આગળ કાર્યવાહી કરવા વિનંતિ.
 - ટાઉન પ્લાનીંગ સ્કીમ બનેલ ન હોય તેવા વિસ્તાર માટે મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતાનો અભિપ્રાય મેળવી તેઓના અભિપ્રાયવાળા લે-આઉટ પ્લાનમાં દર્શાવા મુજબના માપ, ક્ષેત્રફળ તથા લોકેશન અનુસારની સ્થળ પરના માપની ચકાસણી કરી જમીન ખુલ્લી છોડાવવા જરૂરી કાર્યવાહી કરવી અને ફાઈલ લે-આઉટ પ્લાનની એક નકલ મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતામાં તથા બીજી નકલ ડ્રોઈંગ શાખામાં મોકલવા વિનંતિ.
 - ગામતજમાં સમાવિષ્ટ તથા વિસ્તારમાં એસ્ટેટ ખાતાના અભિપ્રાય મુજબ આગળની કાર્યવાહી કરવી તથા સંબંધની વિગતો ચકાસી સંબંધ મુજબ લાગુ સીટી સર્વે નં. તથા એસ્ટેટ તથા ટી.પી.ઓ. ડ્રોઈંગ ખાતાના અભિપ્રાય મુજબની વિગતો દર્શાવી ચકાસવા વિનંતિ.
 - ભાગલા/એકત્રીકરણના કેસમાં ૨ (બે) ટ્રેસીંગની નકલ રજૂ કરાવવી તથા મંજૂરી આપવામાં આવેથી ૧ (એક) નકલ ટી.પી.ઓ., ડ્રોઈંગ બ્રાંચને મોકલી આપવા વિનંતિ.
 - સ્કીમ અમલ તથા બેટરમેન્ટ ચાર્જ અંગે સંલગ્ન ખાતાનો અભિપ્રાય મેળવવા આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.

Date : 10/12/2020

જુની. ફાઈટ સમેન

હેડ ફાઈટ સમેન

ટાઉન પ્લાનીંગ ઈન્સ્પેક્ટર



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, - ડ્રોઈંગ બ્રાંચ

વિકાસ નિયંત્રણ અભિપ્રાય

187

CASE NO. _____

ZONE NZ

Ref :- Description of Land: _____

Date

09/12/2020

T.P.S. No. & Name	<u>66</u>	<u>Saijpur Boghu East (draft sanctioned)</u>	
F. P. No.	<u>46/2</u>	S.P. No.	
Tena. No.		Block No.	
Rev. Village	<u>Saijpur Boghu</u>	R.S. No.	<u>173/3</u>
Block No.		C.S. No.	
Gamtal		Sheet No.	
Election Ward No.			

F.R. 096110923R
Engineer / Architect Name
& Seal & Sign

FOR OFFICE USE ONLY

(I) પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ અંગેનો અભિપ્રાય

નકશા પરથી સ્કેલ રીડીંગ કરતાં રેકર્ડ્સમાં જણાવેલ પ્લોટ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટથી અંદાજે ૧૦૦ મીટરની અંદર / અંદાજે ૧૦૦ થી ૩૦૦ મીટરની અંદર / અંદાજે ૩૦૦ મીટરની બહાર આવે છે.

તારીખ : ૧૦/૧૨/૨૦૨૦

[Signature]

Jr. Drafts man

[Signature]

10/12/2020

Head Drafts man

(II) OPINION OF BUILDING HEIGHT RESTRICTION

(As per reference letter No. AAI/AH/ATCO-22 (NOC)/3497-502, dtd.28/02/2003 & plan approved by airport Authority of India)

Note: The maximum permissible height above ground level (AGL) of the building/structure as mentioned below, is the topmost height of the building / structural member, which includes any kind of fixed or overhanging elements, (e.g. water tank, parapet, lift machine room, stair cabin, antenna, light arresters, etc.)

1. The above mentioned site falls within the Airport critical area / NDB restricted area. , therefore " NO PERMISSION " for construction can be given "UNLESS THE N.O.C. of AIRPORT AUTHORITY" will be obtained and submitted by the applicant.
2. The above mentioned site falls within "specified area/funnel area", commencement certificate can be issued upto the maximum permissible height of 12.00 mts. Above ground level (AGL), subject to the condition that the "N.O.C. of Airport Authority" will be obtained by the applicant before applying for the Building Use permission.
3. By scaling on map which are approved by Airport Authority the above mentioned site is located at a approximate distance of about _____ km, from "A.S.R. (Radar)" commencement certificate can be issued upto the maximum permissible height of 30 mts. above ground level (AGL), subject to the condition that the "N.O.C. of airport Authority" must be obtained and submitted by the applicant before applying for the Building Use permission.
4. By scaling on map which are approved by Airport Authority, the above mentioned site falls within "Funnel Area" located at the distance of about _____ km. from the basic strip of "05 end of runway", commencement certificate can be issued upto the maximum permissible height of 30 mt. above the ground level (AGL), subject to the condition the "N.O.C. of Airport Authority" will be obtained and submitted by the applicant before applying for the building use permission.

Date : 10-12-2020

[Signature]

Jr. Draftsman

[Signature]

10/12/2020

Head Drafts man

AHMEDABAD MUNICIPAL CORPORATION

PART PLAN SHOWING LOCATION AS PER T.P. SCHEME

THIS PART PLAN IS CERTIFIED ONLY FOR FINAL PLOT NO.: **43/2/1** OF
DRAFT TOWN PLANNING SCHEME AHMEDABAD NO:- 66 SAJJPUR BOGHA EAST
Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat
Notification NO:- GH/V/323 of 2006 - TPS - 112006 - 2710 - L Dt.15/12/2006

COLOR NOTE:-

1) BOUNDARY OF FINAL PLOT


2) BOUNDARY OF ORIGINAL PLOT

3) ROAD

4) BOUNDARY OF T.P. SCHEME



SCALE - 1CM=20 M



Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .
(2) IN CASE OF DRAFT T.P. SCHEME THE ABOVE PART-PLAN WILL BE SUBJECT TO CHANGES AS MAY BE SANCTIONED BY GOVERNMENT OF GUJARAT IN THE FINAL T.P. SCHEME .

નોંધ:- આ ફર્મ ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં.પ./૨૦૨૦૦૭૦૬/૮૫/૩ તા. ૮-૯-૨૦૨૦ થી
નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. ૭૩૩/૦૩.....તા. ૮-૯-૨૦૨૦...
૩૧-૧૦-૨૦૨૦...વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

TRUE COPY

[Signature]
9/9/2020

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

TRACER

[Signature]
09/09/2020
JR. DRAFTSMAN

[Signature]
09/09/2020
H.D.

DRAFT TOWN PLANNING SCHEME AHMEDABAD NO. 66 (SAIJPUR-BOGHA-EAST)
THE GUJARAT TOWN PLANNING & URBAN DEVELOPMENT ACT 1976 (RULE 21 & 35.)

FORM-F REDISTRIBUTION, AND VALUATION STATEMENT

ORIGINAL PLOT																FINAL PLOT																VALUE IN RUPEES						Contribution (%)		Increment (Section 78)		Contribution 70% of column 12		Addition (+) or deduction (-)		Net demand from (1) or Deduction by (1) owner		Remarks
Name of Owner		Tenure	Revenue Survey No.	OP NO	OP AREA	VALUE IN RUPEES		FP NO	FP Area in sq.mts	Undeveloped		Developed		Contribution Under Section 80 Column 9(b)-6(b)	column 10(a)-9(a)	column 12	Contribution to be made under other section	column 11, 13, 14	column 15																													
						Without reference to Value of Structure	Inclusive of Structures			Without reference to Value of Structure	Inclusive of Structures	Without reference to Value of Structure	Inclusive of Structures																																			
1	P. Jagdish Co. Op House No. 101 Krishna Nagar, Setaipur, Bogha, Garmahi, Narvali	3	3 (a)	4	5	6 (a)	6 (b)	7	8	9 (a)	9 (b)	10 (a)	10 (b)	11	12	13	14	15	16																													
			173/P	43/1	4359	4751310	4751310	43/1	4027	4389430	4389430	6241850	6241850	-361880	1852420	326210	0	564330	Shares of Owner in FP as per shares in OP. Owner to compensation & pay contribution to their shares in OP																													
	General Jagdish Patel Jagdish Chandra Lal Jagdish Narain w/o Chandra Lal Rajesh Narain Kumar Kamlesh Keshavnagar Kamlesh Keshavnagar		173/P	43/2	1104	1203360	1203360	43/2/1 43/2/2	365 287 652	745200	745200	1662624	1662624	-458160	917424	453712	0	552	Shares of Owner in FP as per shares in OP. Owner to compensation & pay contribution to their shares in OP																													

PREPARED BY *[Signature]*
 CHECKED BY *[Signature]*

સાચી જમીન માટે
 સરકારી કચેરીમાં જઈ
 સર્વેયર સાથે જમીન માપવા
 સરકારી કચેરીમાં જવું

F/20200908/6414 8-9-2020
 સરકારી કચેરીમાં જઈ
 સર્વેયર સાથે જમીન માપવા
 સરકારી કચેરીમાં જવું

TRUE COPY
[Signature]
 9/9/2020